



પરીપત્ર

વિષય : આગામી સમયમાં યોજાનાર પી.જી./બી.એડ. સેમ.-૪ ની પરીક્ષાના, પરીક્ષા ફોર્મની ઓનલાઇન એન્ટ્રી શરૂ કરવા બાબત

આથી ઉપરોક્ત વિષયે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ભવનના અધ્યક્ષશ્રીઓ, યુનિ. સંલગ્ન અનુસ્નાતક કેન્દ્રના પ્રોફેસર્સ ઇન્ટ્યાજ્શ્રીઓ, યુનિ. સંલગ્ન તમામ કોલેજોના આચાર્યશ્રીઓ તથા માન્ય સંસ્થાના વડાઓને જણાવવાનું કે, આગામી સમયમાં યોજાનાર પી.જી./બી.એડ. સેમ.-૪ ની પરીક્ષાના, પરીક્ષા ફોર્મની ઓનલાઇન એન્ટ્રીની તારીખ નીચે મુજબ રહેશે. નિયત સમય-મર્યાદામાં કોલેજ દ્વારા તેમના લોગીન મારફત એન્ટ્રી કરવાની રહેશે.

કોર્સનું નામ	રેગ્યુલર ફી	લેઇટ ફી [રેગ્યુલર ફી + ૫૦૦]	ઠંડાત્મક ફી [રેગ્યુલર ફી + ૫૦૦ + ૧૫૦૦]
પી.જી./બી.એડ. સેમ.-૪	તા.૦૬/૦૪/૨૦૨૨ થી તા.૧૨/૦૪/૨૦૨૨	તા.૧૩/૦૪/૨૦૨૨	તા.૧૬/૦૪/૨૦૨૨

છેલ્લી તારીખ બાદ કરવામાં આવેલ સુધારો સોફ્ટવેર સ્વીકારશે નહીં. ઠંડાત્મક ફી ની તારીખ બાદ પણ જો કોઇ વિદ્યાર્થીનું પરીક્ષા ફોર્મ ઓનલાઇન ભરવાનું બાકી રહેલ હોય, તો તેવા વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ અત્રેની યુનિવર્સિટી ખાતેથી **૬બલ ઠંડાત્મક ફી [ઠંડાત્મક ફી * ૨(બે)]** ભરી ફોર્મ ભરવાનું રહેશે.

ઠંડાત્મક ફી સાથેની છેલ્લી તારીખ બાદ ચાલુ કામકાજના ટિવસ ૧(એક)માં ફરજિયાત પણે ચેકલિસ્ટ તેમજ ફી મેમો પરીક્ષા વિભાગમાં જમા કરાવવાનો રહેશે, જો કોલેજ દ્વારા નિયત સમયમર્યાદા બાદ પરીક્ષા ફોર્મ જમા કરવામાં આવશે, તો તેવી કોલેજના બેઠક નંબર જનરેટ થશે નહીં, જેથી તેની સંપૂર્ણ જવાબદારી જે-તે કોલેજની રહેશે. જેની ગંભીરતાથી નોંધ લેવી તથા પરીક્ષા ફોર્મ ફી "રજીસ્ટ્રાર, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ" ના નામના ડીમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ભરવાની રહેશે.

આગામી સમયમાં યોજાનાર પી.જી./બી.એડ./એલ.એલ.બી. સેમ.-૨ તેમજ યુ.જી. સેમ.-૨ ની પરીક્ષાના, પરીક્ષા ફોર્મ તમામ કોલેજોએ વિદ્યાર્થી પાસેથી ભરાવીને પોતાની પાસે રાખવાના રહેશે, અત્રેની યુનિ. દ્વારા ટૂંક સમયમાં પરીક્ષા ફોર્મની ઓનલાઇન એન્ટ્રી માટેની તારીખ જાહેર કરવામાં આવશે તે દરમિયાન તમામ કોલેજોએ પરીક્ષા ફોર્મની ઓનલાઇન એન્ટ્રી કરવાની રહેશે.

ખાસ નોંધ :

૧. દરેક વિદ્યાર્થીએ પરીક્ષા ફોર્મમાં જે વિષય દર્શાવેલ હોય તે જ વિષયની કોલેજ દ્વારા સોફ્ટવેરમાં એન્ટ્રી કરવી.
૨. કોલેજ દ્વારા પરીક્ષા ફોર્મની એન્ટ્રી થયા બાદ ફરજિયાત વેરીફાય કરી લેવાનું રહેશે. [વેરીફાય કરેલ ફોર્મનું જ ચેકલિસ્ટ/બેઠક નંબર જનરેટ થશે]
૩. રીપીટર વિદ્યાર્થીનાં વિષયમાં ફેરફાર કરી આપવામાં આવશે નહીં, જે કોલેજ તેમજ વિદ્યાર્થીઓએ ધ્યાને લેવું.
૪. પરીક્ષાના આવેદનપત્ર કોલેજ પોતાની પાસે રેકોર્ડમાં સાચવીને રાખવાં, જરૂર પડયે યુનિવર્સિટી દ્વારા મંગાવવામાં આવે તો રજુ કરવાનાં રહેશે.
૫. COVID-19 અંગે સરકારશ્રી દ્વારા વખતોવખત જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકાનું યુસ્તપણે પાલન કરવાનું રહેશે. કર્મચારીઓએ માસ્ક પહેરી (ફેસ કવર) તેમજ સામાજિક અંતર જાળવી ઉપરોક્ત કામગીરી કરવાની રહેશે.
૬. ઉપરોક્ત વિદ્યાશાખાઓ માટેની રેગ્યુલર ફી અત્રેની યુનિવર્સિટીના પરીપત્ર ક્રમાંક-બીકેએનએમયુ/પરીક્ષા/૨૮૯/૨૦૨૨, તા.૨૨/૦૨/૨૦૨૨ મુજબ રહેશે.

ડી. ડી. એમ. યુનિ. યુ. ડી. યુ.
પરીક્ષા નિયામક

ક્રમાંક - બીકેએનએમયુ/પરીક્ષા/૮૩૫/૨૦૨૨

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી,

ગવર્નમેન્ટ પોલીટેકનીક કેમ્પસ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી રોડ,

ખડિયા, જૂનાગઢ-૩૬૨૨૬૩

તા.૦૫/૦૪/૨૦૨૨

પ્રતિ,

યુનિવર્સિટી ભવનના અધ્યક્ષશ્રીઓ, યુનિ. સંલગ્ન અનુસ્નાતક કેન્દ્રના પ્રોફેસર્સ ઇન્ટ્યાજ્શ્રીઓ, યુનિ. સંલગ્ન તમામ કોલેજોના આચાર્યશ્રીઓ તથા માન્ય સંસ્થાના વડાઓ તરફ....

નકલ સવિનય રવાના:-

(૧) માન.કુલપતિશ્રી/કુલસચિવશ્રીના અંગત સચિવશ્રી (જાણ અર્થે)

(૨) હિસાબી શાખા. (યોગ્ય કાર્યવાહી અર્થે)

(૩) આઇ.ટી. સેલ (યોગ્ય કાર્યવાહી તેમજ વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવા અર્થે)

